



જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૮/૧૨/૨૦૧૮ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૫૨૦/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૨૩ કેસ કરી, ૧૩૩ વ્યક્તિઓને ઝડપી, ૧૪૩ લીટર દેશી દારૂ, ૭૨૦ બોટલ ઈંગ્લીશ દારૂ, ૫૩ બીયરટીન ૦૨ કાર અને ૧ સ્ફૂટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૦૭ કેસ કરી ૩૨ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧,૦૧,૮૫૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૫૨૧/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૦૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી-૯૩ મુજબ ૦૬ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૨૫૨૨/૧૮

**સરખેજ :** સ્ટેન્લી જયંતિભાઈ પારકર (ઉ.વ.૪૦)(રહે.રાજકમલ એપાર્ટમેન્ટ, ડેમોક્રેટીક સ્કુલ સામે સિઝેચર બિલ્ડીંગ સરખેજ) એ તા.૨૮/૧૨/૨૦૧૮ નારોજ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે ઓગસ્ટ/૨૦૧૮ સરખેજ સાણંદ સર્કલ પાસે આવેલ સિઝેચર-૨ બિલ્ડીંગ, “સી” બ્લોકની ઓફીસમાં આવેલ “વલ્ડ વાઈઝ વિઝા” નામની ઓફીસમાં આરોપી (૧) જસમિત કોર (૨) નવદીપ કોર અને (૩) મનદિપ કોર (તમામ રહે.”સી” બ્લોક ઓફીસ નંબર ૬૦૮ સિઝેચર -૨ બિલ્ડીંગ, સરખેજ) એ ભેગામળી સ્ટેન્લી તથા અન્ય લોકોને કેનેડા તેમજ અન્ય દેશમાં વર્ક પરમીટ વિઝા આપવાનું જણાવી, ભારત સરકારના ઈમીગ્રેશન કાયદા હેઠળ અધિકૃત એજન્ટ ન હોવા છતાં ગેરકાયદેસર રીતે એજન્ટ તરીકે કામ કરી, સ્ટેન્લી પાસેથી રોકડ રૂપિયા ૭,૯૨૦૦૦/- અને અન્ય માણસો પાસેથી લીધેલ નાણા મળી કુલ રૂપિયા ૩૩,૬૩,૮૮૦/- મતાની મેળવી લઈ તમામ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એન.પી.સોનારા ચલાવે છે.

**ગાયકવાડ હવેલી :** અર્પિતભાઈ સ/ઓ અશોકજી પાટીદાર (ઉ.વ.૧૯)(રહે.ગામ. કોદ તૈહસીલ-બદનાવર જી.ધાર રાજ્ય-મધ્યપ્રદેશ) એ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૮/૧૨/૧૮ ના કલાક ૦૦/૩૦ વાગ્યાના સુમારે જમાલપુર ચાર રસ્તા થી જમાલપુર દરવાજા તરફ આવતા સોનીઓની દુકાન ની બહાર રોડ ઉપર એક અજાણ્યા ફોન ધારકે અર્પિતભાઈને ફોન કરી વટાણા ખરીદવા બાબતે વાત કરી, સાડા સાત ટન વટાણા કુલ કિંમત રૂપિયા ૧,૨૯,૦૦૦/- મતાનો માલ મંગાવી લઈ, તે માલ પેટેના રૂપિયા નહીં ચુકવી અર્પિતભાઈ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.એન સોઢા ચલાવે છે.

શાહીબાગ : સુરભીબહેન ડો/ઓ મદનભાઈ ગર્ગ (ઉ.વ.૨૭)(રહે.પી.જી.હોસ્ટેલ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, શાહીબાગ) એ તા.૨૮/૧૨/૧૮ નારોજ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૦/૧૨/૧૮ બપોરના ૩/૦૦ થી ૪/૦૦ વાગ્યા દરમ્યાન શાહીબાગ સિવિલ હોસ્પિટલ બી.જે.મેડીકલ કોલેજ, ફોરેન્સિક ડીપાર્ટમેન્ટ ખાતે સુરભીબહેનના મોબાઇલ ફોન ઉપર આરોપી સોનુ ચૌહાણનો ફોન આવેલ અને જણાવેલ કે “એમેઝોન AMAZON માંથી રૂપિયા ૫૦૦૦/- નું શોપિંગ કરશો તો તમને એ.સી., ટી.વી. લેપટોપ તથા મોબાઇલ ફોન વગેરે માંથી કોઈપણ એક વસ્તુ વગર પૈસે આપવામાં આવશે” તેવી વાત કરી, સુરભીબહેનને વિશ્વાસમા લઈ, ફોન લેવા સારૂ PAYTM મારફતે આરોપીના મોબાઇલ નંબર ૭૩૬૫૦૬૧૨૮૬ ઉપર કુલ રૂપિયા ૨૯,૩૫૦/- ટ્રાન્સફર કર્યા બાદ કોઈ રૂપિયા રીફંડ નહીં આપી તેમજ ફોન નહીં આપી, સુરભીબહેન સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઇ. શ્રી એ.કે.પટેલ ચલાવે છે.

ધરફોડ:-

સમાચાર યાદી નં.૨૫૨૩/૧૮

ઈસનપુર : શરદકુમાર નર્મદાશંકર ઉપાધ્યાય (ઉ.વ.૬૩)(રહે.ઉપાસના રાજબાગ સોસાયટી, કેનાલ રોડ ઘોડાસર ઇસનપુર) એ ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૭/૧૨/૧૮ ના કલાક ૬/૩૦ થી તા.૨૮/૧૨/૧૮ ના ૧૨/૦૦ વાગ્યાના દરમ્યાન પોતાના મકાનના દરવાજાનો નકુચો તથા બેડરૂમની બારીની લોખંડની જાળી તોડી, અજાણી વ્યક્તિ મકાનમાં પ્રવેશ કરી, તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ૧૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૯૩,૦૫૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એન.જે.મારૂ ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૨૫૨૪/૧૮

સોલા હાઇકોર્ટ : હિરેનભાઈ નિલેષભાઈ પટેલ (ઉ.વ.૧૮)(રહે.કિષ્ના પાર્ક નિર્માણ ટાવર પાસે ચાણક્યપુરી રોડ ઘાટલોડીયા) એ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૭/૧૨/૧૮ ના કલાક ૦૬/૪૦ થી ૭/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના ખુલ્લા મકાનમાં અજાણી વ્યક્તિ પ્રવેશ કરી, અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૪ કુલ કિંમત રૂપિયા ૩૬,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી બી.એમ.પરમાર ચલાવે છે.

અપમૃત્યુ :-

સમાચાર યાદી નં.૨૫૨૫/૧૮

નારોલ : વિક્રમભાઈ દિનેશભાઈ કુશસર મુખિયા (રહે, જેતલપુર ગામ નાઝપીરાણા રોડ કેશવ લક્ષ્મી રાઇસ મીલમાં તા.દસ્કોઇ જી.અમદાવાદ)તા.૨૮/૧૨/૨૦૧૮ ના કલાક ૧૧/૪૫ વાગ્યાના સુમારે કેશવ લક્ષ્મી રાઇસ મીલમાં કામ કરતા હતા દરમ્યાન કોઈ કારણસર યોખા ભરેલા સ્ટોરેજ ટેંક માં પડી જતાં, યોખા માં નીચે ઉતરી જતાં, તેમના ઉપર યોખા આવી જતાં ગુંગળામણ થી વિક્રમભાઈનું મૃત્યુ નિપજ્યુ હતું. આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી રમણભાઈ હીરાભાઈ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૨૫૨૬/૧૮

ઓઢવ : કરીનાબહેન વા/ઓ સોનુભાઇ વણઝારા (ઉ.વ.૨૧)(રહે. શ્યામજીકૃષ્ણ વર્મા ચાર માળીયા વેપારી મહામંડળની પાછળ સીંગરવા ઓઢવ) એ કોઇ અગમ્ય કારણસર તા.૨૭/૧૨/૨૦૧૮ રાતના ૧૦/૫૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. આ અંગે ઓઢવ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મદદનીશ પો.કમી.શ્રી “આઇ” ડીવિઝન નાઓ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.